

M.A. (PSYCHOLOGY) Semester - 3 (CBCS) Examination**DEC/JAN. - 2020 - [NEW COURSE]****Behavior Modification (Elective-5 (New))****Time: 1:30 Hours****Marks: 42****Instructions:**

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- | | | |
|----------|---|------|
| પ્રશ્ન.૧ | વર્તનના આધારસ્તંભ તરીકે ક્રિયાત્મક અભીસંધાન સમજાવો. | (૧૪) |
| પ્રશ્ન.૨ | ઓટોજેનિક રિલેક્ષેશન પદ્ધતિની ચર્ચા કરો. | (૧૪) |
| પ્રશ્ન.૩ | વિશ્રાંતીની પ્રક્રિયાઓ જણાવો. | (૧૪) |
| પ્રશ્ન.૪ | રૂઢિગત વાર્તાનીક-વર્ગીકરણ વર્ણવો. | (૧૪) |
| પ્રશ્ન.૫ | ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) | (૧૪) |
1. વર્તન ફેરફારના પાયાના ખ્યાલો સમજાવો
 2. પ્રતીકાત્મક વ્યવસ્થા સમજાવો
 3. પ્રબલીકરણ કાર્યક્રમ
 4. ધારણાત્મક વર્તન ફેરફાર એટલે શું?

ENGLISH VERSION

- | | | |
|-----|---|------|
| Q.1 | Explain the operant conditioning as a foundation of behaviour modification. | (14) |
| Q.2 | Discuss of the methods of Autogenic relaxation. | (14) |
| Q.3 | Explain the relaxation processes. | (14) |
| Q.4 | Narrate the traditional assessment of behaviour. | (14) |
| Q.5 | Write short note. (any two) | (14) |
1. Explain the basic concept of behaviour modification
 2. Explain the Token economy
 3. Reinforcement program
 4. What is Assumption of behaviour modification?
